

કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, દેવાતજનો ૩૬ મો સ્થાપના દિન ઉજવાયો

કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, આણંદ કૃષિ યુનિવર્સિટી, દેવાતજ ખાતે ૨૦ નવેમ્બર, ૨૦૨૧ના રોજ કેવિકે, દેવાતજના ૩૬મા સ્થાપના દિનની ઉજવણી કરવામાં આવી. સદર કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે શ્રી જયેશભાઈ પટેલ, પ્રગતિશીલ પશુપાલક, ઝારોલા; શ્રી હર્ષદભાઈ રાવજીભાઈ પટેલ, પ્રગતિશીલ ખેડૂત, પીપળાવ; શ્રી વિમલકુમાર કીરીટભાઈ પટેલ, પ્રગતિશીલ ખેડૂત ઇસણાવ અને શ્રીમતી સગુણાબેન દીપકભાઈ પટેલ, પ્રગતિશીલ મહિલા ખેડૂત, ઇસરામા ઉપસ્થિત રહ્યા હતા તથા ફૂલ ઝપ જેટલા ખેડૂત ભાઈ-બહેનો હાજર રહ્યા હતા.

કાર્યક્રમની શરૂઆતમાં વરિષ્ઠ વૈજ્ઞાનિક અને વડાશ્રી, ડો. એ. સી. વૈદ્યએ કાર્યક્રમમાં આમંત્રિત સર્વેનું ભાવભર્યું સ્વાગત ઉદબોધન કર્યા બાદ કેવિકેની મહતા સમજાવી જેમાં કેવિકે દ્વારા છેલ્લાં બે વર્ષ દરમિયાન થયેલ કામગીરી તેમજ ખેડૂતો માટે કરવામાં આવતી વિવિધ પ્રવૃત્તિ વિષે વિસ્તૃતમાં ચર્ચા કરી હતી. ત્યારબાદ શ્રી જયેશભાઈ પટેલે પશુપાલનમાં મૂલ્યવૃદ્ધિ દ્વારા આવક વધારવા અંગેના તેમના અનુભવો તેમજ પશુઓના બાયોવેસ્ટના ઉપયોગ દ્વારા બાયો પ્રોડક્ટસનું ઉત્પાદન કરવા માટે સુચન કર્યું હતું. શ્રી હર્ષદભાઈ પટેલે ગાય આધારીત પ્રાકૃતિક ખેતીનું આજના જમાનામાં મહત્વ અને ખેતી સાથે અન્ય સંલગ્ન પ્રવૃત્તિઓ થકી આવક બમણી કરવાના મુદ્દાઓની સમજ આપી હતી. શ્રી વિમલકુમાર પટેલે જળબ્રાહ્મીની ખેતી વિષે તેમના અનુભવો જણાવ્યા હતા તથા આવા ઔષધીય પાકની ખેતી ગાય આધારીત પ્રાકૃતિક ખેતી દ્વારા કરવાના ફાયદા જણાવ્યા હતા. શ્રીમતી સગુણાબેન પટેલે મહિલાઓને પોતાના કુટુંબને આવક વધારવા કઈ રીતે મદદ થઈ શકે તે બાબતે ચર્ચા કરી હતી. મહિલાઓ બાગાયતી પાકોમાં મૂલ્યવર્ધન તેમજ ધરૂ ઉછેર થકી આર્થિક ઉપાર્જન મેળવી શકે તે બાબતે જણાવ્યું હતું. ડો. વાચ. સી. લકુમ, વૈજ્ઞાનિક (એગ્રોનોમી) એ ગાય આધારીત પ્રાકૃતિક ખેતીમાં મહિલાઓ પણ કઈ રીતે યોગદાન આપી શકે છે તેના વિષે ચર્ચા કરી હતી.

અંતે ડો. આર.એમ. પટેલ, વૈજ્ઞાનિક (પાક સંરક્ષણ) દ્વારા કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, દેવાતજના સ્થાપના દિનની ઉજવણીના કાર્યક્રમમાં હાજરી આપવા બદલ સર્વેનો આભાર વ્યક્ત કરી કાર્યક્રમનું સફળ સંચાલન કરવામાં આવેલ.

